

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૧૨/૨૦૧૫ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૨૫૪૭/૧૫

અગાઉ સંખ્યાબંધ ચોરીના ગુન્હા મા સંડોવાયેલ કાયદાના સંઘર્ષ મા આવેલ કિશોરો ને ચોરીની રોકડ રકમ તથા સિલ્વર ધાતુના સિક્કા તથા ઓટોરિક્ષા તથા એકટિવા તથા ચોરી કરવાના સાધન સાથે ઝડપી પાડતી કાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેર કાઇમ બ્રાન્ચનાં નાયબ પોલીસ કમિશનરશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનતાં લુટ ધાડનાં મિલકત સંબંધી ગુન્હાઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ જેથી પોલીસ સબ ઇસ્પેક્ટર આર.આઇ.જાડેજા તથા એસ.એન.દેસાઇ તથા તથા સ્ટાફનાં માણસો સાથે અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન થલતેજ સુરધારા સર્કલ પાસેથી કાયદાના સંઘર્ષ મા આવેલ કિશોરોને રોકડા રૂપિયા ૭૧,૦૦૦/- તથા સિલ્વર ધાતુનાં સિક્કા તથા ઓટો રીક્ષા મળી કુલ રૂ.૧,૪૬,૧૫૫/- ના મુદામાલ સાથે પકડી સદરી બન્ને કિશોરો કાયદાના સંઘર્ષ મા આવેલ સગીરોને તેમના વાલીઓને પરત સોંપવામાં આવેલ છે

આ કામે પકડાયેલ સગીર વયના કિશોરો અગાઉ બે થી ત્રણ વાર વસ્ત્રાપુર તથા સોલા તથા સેટેલાઇટ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ છે સદરી કિશોરો ની પુછ પરછ દરમ્યાન (૧) એક મહિના પહેલા રાત્રિના સમયે સતાધાર ચાર રસ્તા પાસે આવેલ નિર્માણ ટાવર મા આવેલ લક્ષ્મી સુપર માર્કેટ નામની દુકાનમાથી આશરે રૂપિયા ૫૦,૦૦૦/- ચોરી કરેલ

(૨) ઉપરોક્ત દુકાન માથી ચોરી કરી દુકાન બહાર નીકળતા દુકાન ની બહાર પાર્ક કરેલ એકટીવા ની પણ ચોરી કરેલ

(૩)આજથી એક મહિના પહેલા મોડી રાત્રિનાગોતા ચોકડી પાસે આવેલ દુકાન માંથી પેન્ટ શર્ટ તથા બેલ્ટ તથા અ બુટની જોડીઓ તથા રોકડા રૂ.૫૦૦૦/- ની ચોરી કરેલ

(૪)આજથી દસથી બાર દિવાસ પહેલા ઘાટલોડિયા સોલા રોડ પર આવેલ સુંદરવન એપાર્ટમેન્ટ નીચેની કરિયાણાની દુકાનમાથી રોકડા રૂ.૫૦૦૦/- ની ચોરી કરેલ

(૫)આજથી સાતેક દિવસ પહેલા મોડી રાત્રિનાપિતા ની ઓટોરિક્ષા લઇ ને મેમ્કો ચાર રસ્તા બ્રિજ નીચે આવેલ શ્રીજી મેડીકલ દુકાનનુ તાડુ તોડી તેમાથી રૂ.૨૦૦૦૦/- તથા ટેબલેટ ફોન ની ચોરી કરેલ

(ડ)આજથી પાંચેક દિવસ પહેલા મોડી રાત્રિના ઓટોરિક્ષા લઇને ગુરુકુળ સુભાષ ચોક ચાર રસ્તા પાસે વિશ્રામ નગર સોસાયટી પાસે એક કરિયાણા ની દુકાનમા શટરનુ તાડુ તોડી શટર ખોલી અંદર પ્રવેશ કરેલ પરંતુ અંદર થી કઇ રોકડ રકમ ન મળેલ નહી બાદ તેજ રાત્રિના થલતેજ ગામ મા ગયેલ અને કરિયાણા ની દુકાન નુ તાડુ તોડેલ પરંતુ તેમાથી પણ કઇ મળેલ નહી અને તેજ રાત્રિના સતાધાર ચાર રસ્તા પાસે રોડ ની સાઇડે ઓટોરિક્ષા પાર્ક કરી ચાલતા બિગબજાર પાસે એક મેડીકલ દુકાન નુ શટલ નુ તાડુ તોડી તેમા અંદર પ્રવેશ કરી કાઉન્ટરમા જુદા જુદા ખાના માથી મળેલ પર્સ માંથી રૂ.૭૦,૦૦૦/- રોકડ રકમ તથા સિલ્વર ધાતુના સિક્કાઓ તથા રૂ.૨ અને રૂ.૧ ના દરની નોટો ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે તેમજ આ સિવાય બીજા કોઇ ગુન્હા કરેલ છે કે કેમ તે દિશામાં તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.